



**MBS-1601290202041000** Seat No. \_\_\_\_\_  
**M. A. (Sem. IV) (CBCS) Examination**  
**April / May - 2018**  
**Home Science : CCT - 10**  
*(Food Science - II)*  
*(New Course)*

Time :  $2\frac{1}{2}$  Hours] [Total Marks : 70

- |      |   |    |
|------|---|----|
| ૧    | ન્યુક્લીક એસિડ એટલે શું ? ન્યુક્લીઓસાઈડ, ન્યુક્લીઓટાઈડ,<br>પોલી ન્યુક્લીઓટાઈડ અને D.N.A., R.N.A. વિશે સમજાવો.   | ૧૪ |
| અથવા |   |    |
| ૧    | બી.એમ.આર. માપવાનાં ધોરણો અને તેનું મહત્વ સમજાવો.  | ૧૪ |
| ૨    | બફર્સનાં ગુણધર્મો અને અગત્યતા સમજાવો.   | ૧૪ |
| અથવા |   |    |
| ૨    | એસિડનો અર્થ, વ્યાખ્યા અને ગુણધર્મો વિશે સમજાવો.   | ૧૪ |
| ૩    | બી.એમ.આર.ને અસરકરતાં પરિબળોની ચર્ચા કરો.  | ૧૪ |
| અથવા |   |    |
| ૩    | બેઇઝનો અર્થ, વ્યાખ્યા અને ગુણધર્મો વિશે લખો.  | ૧૪ |
| ૪    | પ્રોટીન અને કેલરી તેમજ વિટામીન-સી વચ્ચેનાં સહસંબંધો સમજાવો.   | ૧૪ |
| અથવા |   |    |
| ૪    | કાર્બોહિટ, પ્રોટીન અને ચરબીની વિટામીન પર થતી અસરો તેમજ કારો<br>વચ્ચેનાં સહસંબંધો વિશે લખો.  | ૧૪ |
| ૫    | ટૂકનોંધ લખો : (કોઈપણ બે)<br>(૫.૧) વિટામીન અને ક્ષારનાં સહસંબંધો<br>(૫.૨) એસિડના પ્રકારો<br>(૫.૩) વિટામીન અને ક્ષારની અગત્યતા<br>(૫.૪) બેઇઝનાં પ્રકારો | ૧૪ |

## **ENGLISH VERSION**

- 1** What is nucleic acid ? Nucleoside, nucleotide, poly nucleotide and D.N.A., R.N.A. – Explain. **14**

**OR**

- 1** Explain the norms for measuring B.M.R. and it's importance. **14**

- 2** Explain the properties and an importance of buffers. **14**

**OR**

- 2** Explain about meaning, definition and properties of acid. **14**

- 3** Discuss and affecting factors of B.M.R. **14**

**OR**

- 3** Write about the meaning, definition and properties of base. **14**

- 4** Explain an inter relationship between protein and calorie and vitamins to vitamins. **14**

**OR**

- 4** Write about an effects of carbohydrates, protein and fat on vitamin and interrelationship between minerals to minerals. **14**

- 5** Write short note : (Any Two) **14**

(5.1) An interrelationship between vitamin and mineral.

(5.2) Types of acid.

(5.3) An importance of vitamin and mineral.

(5.4) Types of base.